



પરિપત્ર નં. ૧૨૩ તા.૦૪-૦૩-૨૦૨૦

ફક્ત મ્યુનિ. શાળાઓ માટે જ :-

વિષય :- Follow these important precaution for reduce the risk of corona virus infection.

સંદર્ભ :- નં.એસએસએ/મકમ/૨૦૨૦/૮૬૮૭-૮૭૮૧ તા.૨૦-૦૨-૨૦૨૦

નમસ્તે અમદાવાદ.....

છોડો



અપનાવો



Namaste

આથી તમામ મ્યુનિ. શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર વર્તાઈ રહ્યો છે ત્યારે આ વાયરસથી ગભરાવાના બદલે આ વાઈરસ ચેપી હોવાથી તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. તકેદારીના ભાગ રૂપે બાળકોને ચેપી રોગ ફેલાય નહી તે માટે આ સાથે સામેલ બિડાણના પત્રના અને નીચે જણાવ્યા મુજબના સૂચનોનું પાલન થાય અને વધારેમાં વધારે જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો કરવા જણાવવામાં આવે છે. કોરોનાથી બચવા માટે શેક હેન્ડ છોડીને રોજ રોજ મળનાર મિત્રો, સ્નેહીજનોને 'નમસ્તે' કહીએ

એક સંશોધન મુજબ શેક હેન્ડથી ૧૨૪ મિલિયન બેક્ટેરીયા ટ્રાન્સફર થાય છે. જ્યારે નમસ્તેથી ઝીરો બેક્ટેરીયા ટ્રાન્સફર થાય છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માન.મ્યુનિ.કમિશનરશ્રી વિજય નેહરા IAS સાહેબે પણ શેક હેન્ડ છોડીને નમસ્તે કરવા અપીલ કરી છે આ અપીલને આપણે સૌ આવકારીએ અને ઘર ઘર સુધી આ અપીલ પહોંચે તેવા પ્રયાસ કરીએ.

કોઈપણ ચેપી રોગથી બચીએ..... નીચેની બાબતોનું પાલન કરીએ.....

- વ્યક્તિગત સ્વચ્છતા સારી રીતે જાળવો
- સાબુથી વારંવાર હાથ ધોવા
- શ્વાસોચ્છોશ્વાસ મૂળભૂત સભ્યતા પાળો- ઉધરસ અને છીંક ખાતી વખતે મોંને ઢાંકો
- સાબુ અને વહેતા પાણીથી હાથ ધોવો(જ્યારે હાથની ગંદકી નરી આંખે દેખાય)
- સ્પિરીટ/આલ્કોહોલ આધારિત હેન્ડવોશ કે સાબુ તથા પાણીથી હાથ ધોવા (જ્યારે હાથ નરી આંખે ગંદા ન દેખાય)
- ટિસ્સુનો ઉપયોગ કર્યા બાદ તરત જ બંધ કચરાપેટીમાં નાંખો
- કફ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાકીદે ડોક્ટરને બતાવો.



- તાવ, ખાંસી કે ઉધરસ આવતી હોય તેવી વ્યક્તિથી ૧ મીટર દૂરથી વાતચીત કરો.
- ટોઈલેટ જઈને આવ્યા બાદ સાબુથી વ્યવસ્થિત હાથ ધોવા.
- માંદા માણસને સ્પર્શ કરતાં પહેલાં અને બાદમાં સાબુથી વ્યવસ્થિત હાથ ધોવા.
- જમ્યા પહેલાં અને બાદમાં સાબુથી વ્યવસ્થિત હાથ ધોવા.
- પુરી બાંયના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.
- અને ત્યાં સુધી મેળા, મેળાવડા, મિટીંગ જેવી જાહેર જગ્યાએ જવાનું ટાળવું.
- જાહેરમાં થુકવું નહીં
- જીવંત પશુઓનો સંપર્કમાં તથા કાચા કે રંધાયેલ માસનું સેવન કરવું નહીં.
- મરઘા ઉછેર કેન્દ્ર, પશુ બજાર કે કતલખાનાની મુલાકાત લેવી નહીં.


નોવેલ કોરોના વાયરસ (COVID19)

“ સ્વંયને અને અન્યોને બચાવો ”

તમારી સહાય કરવા માટે, અમારી સહાય કરો

આ સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા સૌ સારસ્વત મિત્રો, બાળકોને અપીલ કરવામાં આવે છે.

NAMASTE



AMADAVAD

શેક હેન્ડ છોડીનમસ્તે કરો.....

આપણી સંસ્કૃતિ અપનાવો..... નમસ્તે કરો.....

બિડાણ :- સંદર્ભિત પત્ર.

તા.૦૪-૦૩-૨૦૨૦

ડૉ. એલ.ડી.દેસાઈ
શાસનાધિકારી

નં. એસએસએ/મકમ/૨૦૨૦/
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા
સેક્ટર-૧૭, ગાંધીનગર
તા. .૦૨.૨૦૨૦

પ્રતિ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી

જિલ્લા. તમામ

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,

જિલ્લા પ્રોજેક્ટ કચેરી, એસએસએ,

જિ. તમામ

એડી. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને

શાસનાધિકારીશ્રી,

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,

જિ. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા

વિષય : Follow these important precautions for reduce the risk of coronavirus infection.

સંદર્ભ: શિક્ષણ વિભાગના તા.૧૫.૨.૨૦૨૦ ના પત્ર ક્રમાંક:પરચ/૧૨૨૦૨૦/૧૦૬/વ.૨

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, સંદર્ભ દર્શિત પત્ર સાથે બિડાણે આવેલ ભારત સરકારના માનવ સંશાધન વિકાસ વિભાગના તા.૫.૨.૨૦૨૦ ના પત્રની નકલ બિડાણ સહિત આ સાથે મોકલી આપતાં જણાવવાનું કે, કોરોના વાયરસ ચેપનું જોખમ ઘટાડવા માટે આ સાથે સામેલ મહત્વપૂર્ણ સાવચેતીઓનું પાલન આપની તાબા હેઠળની રાજ્યની તમામ શાળાઓમાં (ધોરણ-૧ થી ૧૨) આ સાથે સામેલ ભારત સરકારના પત્રમાં આપેલ સૂચનાઓ પરિપત્રિત કરવા આપની કક્ષાએથી નિયમાનુસારની કાર્યવાહી કરવા વિનંતી.



સચિવ

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ
સમગ્ર શિક્ષા, ગાંધીનગર

નકલ સવિનય રવાના જાણ સારૂ:

- માન.સચિવશ્રી (પ્રા. અને મા. શિક્ષણ), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- નિયામકશ્રી, નિયામકશ્રી શાળાઓની કચેરી, બ્લોક નં.-૮/૧, ડાં. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.-૧૨/૧, ડાં. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

નકલ રવાના જાણ સારૂ:

- શ્રી પી.ડી.પટેલ, સેક્શન અધિકારીશ્રી, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

ગુજરાત સરકાર

શિક્ષણ વિભાગ

સચિવાલય, ગાંધીનગર

તા, ૧૫/૦૨/૨૦૨૦

પ્રતિ

- (૧) કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી, બ્લોક નં ૯, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- (૨) નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, બ્લોક નં ૧૨, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- (૩) નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ સેક્ટર નં ૧૨ ગાંધીનગર
- (૪) કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણની કચેરી, બ્લોક નં ૧૨, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- (૫) કમિશ્નરશ્રી, ટેકનિકલ શિક્ષણની કચેરી, બ્લોક-૨/૬ કર્મચોગી ભવન, સેક્ટર-૧૦એ, ગાંધીનગર
- (૬) કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજના, બ્લોક નં ૧૪, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- (૭) સ્ટેટ પ્રોજેક્ટ નિયામકશ્રી, સર્વ શિક્ષા અભિયાન, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ, સેક્ટર નં ૧૭ ગાંધીનગર
- (૮) સચિવશ્રી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર નં ૧૦બી, ગાંધીનગર
- (૯) નિયામકશ્રી, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- (૧૦) નિયામકશ્રી, ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ, સેક્ટર-૧૦, ગાંધીનગર
- (૧૧) સચિવશ્રી, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર ૨૧ ગાંધીનગર
- (૧૨) સેક્શન અધિકારીશ્રી, સર્વે શાળાઓ, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

વિષય:- Follow these important precautions for reduce the risk of coronavirus infection

શ્રીમાન,

ઉપર્યુક્ત વિષય પરત્વેના ભારત સરકારના માનવ સંશાધન વિકાસ વિભાગના તા.૦૫/૦૨/૨૦૨૦ના પત્રની નકલ બિડાણ સહિત આ સાથે સામેલ રાખી મોકલી આપતાં જણાવવાનું કે, કોરોના વાયરસ ચેપનું જોખમ ઘટાડવા માટે આ સાથે સામેલ મહત્વપૂર્ણ સાવચેતીઓનું પાલન રાજ્યની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી તેમજ સરકારી ઇન્સ્ટિટ્યુટ થાય માટે સૂચનો પરિપત્રિત કરવા નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે.

મા ડી ડી
મા ડી ડી ન ન ન સી.

બિડાણ:-ઉપર મુજબ.

143
12/2/2020

Est
12/2

આપનો વિશ્વાસુ

પી.ડી.પટેલ
(પી.ડી.પટેલ)

સેક્શન અધિકારી

શિક્ષણ વિભાગ



PS
GK052
14 FEB 2020
शिक्षण विभाग
नवा सचिवालय, मांझीनगर



भारत सरकार
स्वास्थ्य एवं परिवार कल्याण विभाग
स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय

Government of India
Department of Health and Family Welfare
Ministry of Health and Family Welfare

प्रीति सूदन, आईएएस

सचिव

PREETI SUDAN, IAS
Secretary

D.O.No. Secy(HFW)/IMP/Coronavirus/2020

Dated : 5th February, 2020

II copy
C S Office
78764
Dt. 6/2/2020
13/2/2020

Dear *Amit*,

You may be aware of the Novel Coronavirus reported from China and 24 other countries, 3 travel related case in India. Though much is not known about the disease dynamics, it is evident that there is human to human transmission. As of now, there is no drug or vaccine available to manage this disease. Hence preventive measures become crucial to stop spread of this disease.

CS
h
Creating awareness among university/college students about preventive interventions such as frequent hand wash, respiratory etiquettes (using handkerchief over mouth while coughing/ sneezing, use of tissue paper or using the sleeve of shirt covering upper arm, staying away from college when sick, avoiding public gatherings etc) will help in preventing/ reducing transmission of not only this disease, but also large number of other communicable diseases, notably flu like illnesses. Further, such informed youth can be agents of change for their family, community and beyond.

5(H&FWD)
5(H&T.ED)
4(Kr. Edu)
In view of the above, you are requested to take up with State Education Departments, central universities and other autonomous teaching institutions under your ministry to sensitize their students these simple public health measures that will go a long way in preventing spread of Novel Coronavirus disease. An information pamphlet is enclosed which would come handy for the teachers to sensitize the students.

Yours sincerely
pd
(Preeti Sudan)

Sealed

JS(02)


106/w 2
24/2/20
Shri Amit Khare
Secretary
Department of Higher Education
Ministry of Human Resource Development,
Shastri Bhawan, New Delhi

✓ Copy to: Chief Secretaries of all States/UTs for similar action.



Ministry of Health & Family Welfare
Government of India


Reduce the risk of Coronavirus infection Follow these important precautions



1
Wash hands with soap and water frequently



2
When coughing and sneezing, cover mouth and nose with handkerchief, tissue or elbow



3
Avoid close contact with anyone with cold, cough or flu like symptoms



If you have cough, fever or difficulty in breathing, contact a doctor immediately

Stay protected!

Stay safe from Coronavirus!

If you have returned from Wuhan China after January 15, then get yourself tested for 2019-nCoV. To know about the centres for testing, call the Ministry of Health and Family Welfare Helpline

If you have returned from China in the last 15 days or have been in contact with any person affected by Coronavirus, then limit your contact with others and use a separate room for sleeping

If you develop fever, cough and difficulty in breathing within 28 days of return from China, immediately call the Ministry of Health and Family Welfare Helpline




+91-11-23978046

or email at ncov2019@gmail.com



स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय
भारत सरकार

कोरोना वायरस संक्रमण का खतरा घटाएं ये सरल उपाय अपनाएं



नियमित रूप से साबुन
और पानी से हाथ धोएं



खांसते या छींकते समय नाक
और मुँह टिश्यू या कोहली से ढकें



जिस व्यक्ति में खाँसी, जुकाम या
बुखार के लक्षण हों उससे दूरी बनाएं



अगर खाँसी, बुखार या साँस
लेने में परेशानी हो तो तुरंत
डॉक्टर से संपर्क करें

सुरक्षित
रहें!

कोरोना वायरस
से बचे रहें!

यदि आप पिछले 15 जनवरी
के बाद बुहान चीन से लाटे हैं,
तो अपने आप को 2019-nCoV
के लिए टेस्ट जरूर करवाएं।
टेस्ट करवाने के स्थान की
जानकारी के लिए स्वास्थ्य एवं
परिवार कल्याण मंत्रालय
भारत सरकार के हेल्प लाइन
पर कॉल करें :

यदि आप पिछले 15 दिनों में
चीन से लाटे हैं, या कोरोना
वायरस से संक्रमित किसी
व्यक्ति के संपर्क में आए हैं,
तो अगले 14 दिनों के लिए सब
के साथ संपर्क सीमित करें
और अलग कमरे में सोयें।

चीन से लाटने के बाद 28 दिन
के भीतर, अगर आपको
बुखार, खाँसी या साँस लेने में
तकलीफ जैसी कोई भी
समस्या हो, तो तुरंत स्वास्थ्य
एवं परिवार कल्याण मंत्रालय
भारत सरकार के हेल्पलाइन
नंबर पर कॉल करें :


+91-11-23978046

अधिक जानकारी के लिए: 2019@amcaib.in




Ministry of Health & Family Welfare
Government of India


Reduce the risk of Coronavirus infection Follow these important precautions




1
Avoid travel if you are suffering from fever and cough



2
Wash your hands frequently with soap and water



3
Share your travel history with your health worker (ASHA/ ANM)



If you have cough, fever or difficulty in breathing, contact a doctor immediately

Stay protected! Stay safe from Coronavirus!

If you have returned from Wuhan, China after January 15, then get yourself tested for 2019-nCoV. To know about the centres for testing, call the Ministry of Health and Family Welfare Helpline

If you have returned from China in the last 15 days or have been in contact with any person affected by Coronavirus, then limit your contact with others and use a separate room for sleeping

If you develop fever, cough and difficulty in breathing within 28 days of return from China, immediately call the Ministry of Health and Family Welfare Helpline

24x7 +91-11-23978046

or e-mail: ncov2019@gmail.com



Ministry of Health & Family Welfare
Government of India


Reduce the risk of Coronavirus infection Follow these important precautions



1

After coughing and sneezing

Remember to wash hands with soap frequently




4

After using toilet



2

Clean your hands before and after caring for sick person



3

Before cooking, after cooking and before eating food



If you have cough, fever or difficulty in breathing, contact a doctor immediately

Stay protected!

Stay safe from Coronavirus!

If you have returned from Wuhan, China after January 15, then get yourself tested for 2019-nCov. To know about the centres for testing, call the Ministry of Health and Family Welfare Helpline

If you have returned from China in the last 15 days or have been in contact with any person affected by Coronavirus, then limit your contact with others and use a separate room for sleeping

If you develop fever, cough and difficulty in breathing within 28 days of return from China, immediately call the Ministry of Health and Family Welfare Helpline



+91-11-23978046

or email at nCoV2019@gmail.com